

ટાઇટલ : ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ માં આઈસેક (આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ ઈન એનર્જી એફિશિયન્સી એન્ડ કલાઇમેટ ચેઇન્જ (AISECC) તેમજ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સેન્ટર ઓફ એક્સિલન્સ , મોગર (આઈસેમ)નું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું

DJMIT કોલેજ, મોગર ખાતે તારીખ ૨૭/૮/૨૦૨૦ ના રોજ આઈસેક (આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ ઈન એનર્જી એફિશિયન્સી એન્ડ કલાઇમેટ ચેઇન્જ (AISECC) નું ઈ-લોન્ચિંગ શ્રી એસ. જે. હૈદર (IAS), અગ્ર સચિવ, કલાઇમેટ ચેઇન્જ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા કરાયું હતું જ્યારે IOT Centre of Excellence, Mogar (ICEM) નું ઈ-લોન્ચિંગ શ્રી હારિત શુક્લા (IAS), સેક્રેટરી, સાયન્સ & ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ગાંધીનગર મારફત કરાયું હતું. આઈસેક ડૉ. અજય દેશપાંડે (પર્યાવરણ વિશેષજ્ઞ) ના માર્ગદર્શન માં તથા આઈસેમ જાણીતા ઉદ્યોજક , બરોડા એનર્જી મીટર, વિઠ્ઠલ ઉદ્યોગ નગર આણંદ ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિઠ્ઠલ કામત ના માર્ગદર્શન માં કામ કરશે. ગુજરાત માં સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કોલેજ દ્વારા કરવામાં આવેલી આ નોંધપાત્ર , મહત્વની પહેલ છે. આ પહેલ નો મુખ્ય ઉદ્દેશ કોલેજ માં શિક્ષણ સમયગાળામાં ઊર્જા સંરક્ષણ, પર્યાવરણ માં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , રોબોટિક્સ , મશીન લર્નીંગ , અદ્યતન સોફ્ટવેર ડેવલપમેન્ટ ટેકનોલોજી , બીઝનેસ ઇન્ક્યુબેશન જેવા ઉભરતા નવીન ક્ષેત્રો વિષે વિશેષ જ્ઞાન, ટ્રેનિંગ તથા બેન્કો દ્વારા પ્રોજેક્ટ એપ્રેઝલ અને નાણાકીય સહાય નું માર્ગદર્શન આપી , આત્મ નિર્ભર ભારત ની ધ્યેય સિદ્ધિ સહીત વિદ્યાર્થીઓ ને ઉત્તમ અને ઉજ્જવળ રોજગારી અને ઉદ્યોજકતા (Entrepreneurship) પુરી પાડવાનો તથા કારકિર્દી ની જળહળતી તકો પ્રદાન કરવાનો છે.આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ એક્સપર્ટ્સ તથા તમામ સ્ટાફ ડિજિટલ પ્લેટફોર્મ ના માધ્યમ થી જોડાયા હતા. સંસ્થા ના સંચાલક કે એમ સોલંકી , એકેડેમિક ડિરેક્ટર ડૉ. એફ. એસ. ઉમરીગર તથા કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. બી. આર. પારેખ દ્વારા AISECC તથા ICEM ના સફળ ઈ-લોન્ચિંગ નિમિત્ત શુભેચ્છા પાઠાવવામાં આવી હતી.